

KENVI JEWELS LIMITED

Registered Office: Shop No. 121 & 122 Super Mall Complex, Nr Lal Bungalow, CG Road,
Ahmedabad-380006 Gujarat, India

CIN: L52390GJ2013PLC075720

E-Mail: compliance.kjl@gmail.com

Website: www.kenvijewels.com

Ph.: +91-9169169500

Date: October 21, 2023

To,
The General Manager-Listing
Corporate Relationship Department,
BSE Limited,
Phiroze Jeejeebhoy Towers Dalal Street
28th Floor, Dalal Street, Mumbai- 400001
Scrip Code - 540953

Subject: Submission of copies of Newspaper Advertisement pursuant to Regulation 47 of the SEBI (LODR) Regulations, 2015

Reference: Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015

With reference to above, please find enclosed the copy of newspaper advertisement dated 21st October 2023, which was published in Newspapers Business Standard and Jai Hind-Ahmedabad edition with regard to the unaudited Financial Results of the Company for the Quarter ended 30th September, 2023, duly reviewed by Audit Committee and approved by Board of Directors at their meeting held on October 20, 2023.

You are requested to take the same on records, upload at your website & intimate the same to the members of the Stock Exchange.

Thanking You
Yours Faithfully

For, Kenvi Jewels Limited

VALANI
CHIRAGKUMAR

Chiragkumar C. Valani
Managing Director
DIN: 06605257

PUBLIC NOTICE

It is hereby informed to public at large that N.A.S.No. 483/1 Paiki House on Plot No. 16, Known as Vraj Vihar Society, Situated at Modasa, Taluka: Modasa, Dist: Anval, purchased by Patel Meenaben Jagdishkumar...

In Respect of said property or against land, if any person institution or any one has any kind of right, title or interest on the said property is taken under attachment or lien if any objection if prevailed upon then to inform to us with supporting documents within 7 (seven) days by R.P.A.D to us, and in failure of which nobody has any kind of Right on the title or interest of Borrowing or share etc.

Instruction of Applicant - Nilesh B. Kothari, Advocate Office : D/5, Ground Four Balaji Complex, Malpur Road, Modasa, Dist. Aravalli. M.: 9426338459, 9773013932

Table with 7 columns: Sr. No., Particulars, Quarter ended on 30-09-2023, Quarter ended on 30-06-2023, Quarter ended on 30-09-2022, Half Year ended on 30-09-2023, Half Year ended on 30-09-2022, Year ended on 31-03-2023. Rows include Total Income, Net Profit, Total Comprehensive Income, etc.

Notes: (1) The above Financial Results were reviewed by the Audit Committee and Approved by the Board of Directors at their respective Meetings held on 20 October, 2023. (2) The Statutory Auditors have carried out Limited Review of the above standalone financial results for the quarter ended 30th September 2023 as required under Regulation 33 of SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015.

IDFC FIRST Bank Limited (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited) CIN : L65110TN2014PLC097792 Registered Office: KRM Towers, 8th Floor, Harrington Road, Chetpet, Chennai - 600031.

APPENDIX IV (Rule 8(1)) POSSESSION NOTICE (For Immovable Property) Whereas the undersigned being the authorized officer of IDFC First Bank Limited (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002...

Table with 5 columns: Loan Account Number, Borrower's/Co-borrower's & Guarantors Name, Description of The Mortgaged Properties, Demand Notice Date, Outstanding Amount (Rs.), Date and Type of Possession Taken. Includes details for loans 24813212 and 27535435.

The Borrower/Co-borrowers/ Guarantors in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of IDFC First Bank Limited (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited) for an amount mentioned in the demand notice together with further interest and other charges from the date of demand notice till payment/realization.

Gujarat Pollution Control Board

It is hereby notified to inform that as per Ministry of Environment, Forests & Climate Change, Government of India, New Delhi vide its Notification no. S.O. 1533 (II) dated September 14, 2006, Public Hearing has been fixed for Mo's Refractory Metals & Tubes Limited for setting up Manufacturing of "Metallurgical Industries (Ferrous and Nonferrous)" - (1) Stainless Steel Seamless and Welded Pipes & Tubes - 10,000 MT/Year to 7,500 MT/Year, (2) Stainless Steel Hot extruded and Cold finished Pipes & Tubes - 29,000 MT/Year and (3) Fin Tube - 1,000 MT/Year, at Survey No. 409, 412, 413, 414, 415, 421, 423/1, Ahmedabad - Mehsana Highway, Village: Indraya, Tal. Kadi, Dist. Mehsana, covered under project category "B" as mentioned in its request application.

All local affected persons of the project are requested to remain present in the public hearing or send their response in writing to Member Secretary, Gujarat Pollution Control Board before the hearing date.

Other concerned persons having a plausible stake in environment aspects of the project or activity can submit their responses to Member Secretary, Gujarat Pollution Control Board in writing before the hearing date.

It may be noted that draft Environmental Impact Assessment Report and Executive Summary of the Environmental Impact Assessment Report of the project has been sent to the following authorities or offices to make it available for inspection to the public during normal office hours, till the Public Hearing is over.

- 1. District Collector Office, Mehsana. 2. District Development Office, Mehsana. 3. District Industry Centre, Mehsana. 4. Taluka Development Office, Ta. Kadi, Dist. Mehsana. 5. Regional Office, Integrated Regional Office, Ministry of Environment, Forests and Climate Change, Room No. 407, Aranya Bhawan, Near CH-3 Circle, Sector - 10A, Gandhinagar, Gujarat - 382010. 6. Regional Office, Gujarat Pollution Control Board, Mehsana. H/3, A-Phase I, GIDC Estate, Near GIDC Office, Modhara Road, Mehsana - 384 002.

The District Magistrate /District Collector / Deputy Commissioner or his/her representative not below the rank of an Additional District Magistrate or any other District Level Officer authorized by him/her in this behalf shall supervise and preside over the entire public hearing process.

(Note: If a project or activity is confined to the territorial jurisdiction of one sub-division, the District Magistrate/District Collector/Deputy Commissioner may alternatively authorize any officer not below the rank of Sub-Divisional Magistrate to supervise and preside over the entire public hearing process.)

The Public Hearing is scheduled to be held on 01/12/2023 at 11:30 Hrs. Venue: Ratnagar, Behind Refractory Metals and Tubes & Hotel Purit, Opp. Torrent Pharmaceuticals, Indraya Road, Ahmedabad - Mehsana Highway, Ta. Kadi, Dist. Mehsana.

Considering the present situation of pandemic of Covid-19 all concerned are hereby informed to follow Government guidelines regarding Covid-19 pandemic.

Place: Gandhinagar Date: 19/10/2023 D. M. Thaker Member Secretary

SONATA SOFTWARE LIMITED CIN : L72200MH1994FLC082110 Registered Office: 208, T.Y. Industrial Estate, 2nd Floor, S.K. Ahire Marg, Work, Mumbai - 400 030 Corporate Office: Tower A, Sonata Towers, Global Village (Sattva Global City), RVCE Post, Kengeri Hobli, Mysore Road, Bengaluru - 560059 Tel: +91 80 6778 1000 E-mail: info@sonata-software.com website: www.sonata-software.com

Notice on deduction of Tax at Source on Interim Dividend, if any, declared during FY 2023-24

As per Income Tax Act 1961 ("the Act"), dividends paid or distributed by a Company shall be mandatorily required to deduct tax at source (TDS) at the time of making payment of dividend, if any, declared during FY 2023-24. The TDS rate would vary depending on the residential status of the shareholder and the documents submitted by them and accepted by the Company.

The necessary documents are required to be uploaded at https://ris.kfintech.com/form15/ on or before 2nd November, 2023 in order to enable the Company to determine the appropriate withholding tax rate applicable at the time of declaration of interim dividend, if any, during FY 2023-24. We request you to visit https://www.sonata-software.com/about-us/investor-relations for detailed instructions regarding TDS. We request all shareholders to register their email IDs for effective communication. The aforementioned details are also available on the website of the Company at www.sonata-software.com.

The Notice is also available on the Company's website www.sonata-software.com and on the website of the stock exchanges where the Company's shares are listed viz.: www.bseindia.com and www.seindia.com.

For Sonata Software Limited Mangal Kulkarni Company Secretary, Compliance Officer and Head-Legal

HERO HOUSING FINANCE LIMITED Regd. Office: 39, Community Centre, Basant Lok, Vasant Vihar, New Delhi - 110057 Phone: 911 49267000, Toll Free Number: 1800 212 8900, Email: customer.care@herohf.com Website: www.herohousingfinance.com CIN: U55192DL2016PLC30148 Contact Address: Building No. 27, 2nd Floor, Community Center, Basant Lok, Vasant Vihar, New Delhi - 110057

DEMAND NOTICE Under Section 13 (2) of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 ("Act") read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 ("Rules"). Whereas the undersigned being the Authorized Officer of Hero Housing Finance Limited (HHFL) under the Act and in exercise of powers conferred under Section 13(2) read with Rule 3 of the Rules already issued detailed Demand Notices dated below under Section 13(2) of the Act, calling upon the Borrower(s)/Co-Borrower(s)/Guarantor(s) (as individually or together referred to as "Obligors"/Legal Heir(s)/Legal Representative(s)) listed hereunder, to pay the amounts mentioned in the respective Demand Notices, within 60 days from the date of the respective Notice(s), as per details given below. Copies of the said Notice(s) are served by Registered Post A.D. and are available with the undersigned, and the said Obligor(s)/Legal Heir(s)/Legal Representative(s), may, if they so desire, collect the respective copy from the undersigned on any working day during normal office hours.

Table with 4 columns: Loan Account No., Name of Obligor(s)/Legal Heir(s)/Legal Representative(s), Total Outstanding Dues (Rs.) as on below date, Date of Demand Notice. Includes details for HHSURHO01 and HHSURHO02.

Description of the Secured Assets/Immovable Properties/Mortgaged Properties: All that piece and parcel of Residential Plot No. 162 measuring about 41.28 sq.m. together with undivided proportionate share in Road and COP measuring about 30.85 Sq.M. total measuring about 72.23 sq.m. B Type of Madhavani Residential constructed on land bearing survey No. 115 and 114 Paikar and its block No. 81 adjoining to village from No. 7 and 12 lot measuring about 30756 sq.m. of Karel Sub District Old District Surat. Gujarat-394310. With common amenities written in Title Document Bounded By: North-Plot No. 187, South-Road, East-Plot No. 161, West-Plot No. 163.

*With further interest, additional interest at the rate as more particularly stated in respective Demand Notice dated mentioned above, incidental expenses, costs, charges etc. incurred till the date of payment and/or realization. If the said Obligor(s) fail to make payment to HHFL as aforesaid, then HHFL shall proceed against the above Secured Assets/Immovable Properties under Section 13(4) of the said Act and the applicable Rules entirely at the risk of the said Obligor(s)/Legal Heir(s)/Legal Representative(s) as to the costs and consequences. The said Obligor(s)/Legal Heir(s)/Legal Representative(s) are prohibited under the said Act to transfer the aforesaid Secured Assets/Immovable Property, whether by way of sale, lease or otherwise, without the prior written consent of HHFL. Any person who contravenes or abets contravention of the provisions of the Act or Rules made thereunder shall be liable for imprisonment and/or penalty as provided under the Act. Date: 21-Oct-2023 Place: Surat Sd/- Authorized Officer, For Hero Housing Finance Limited

PEGASUS ASSETS RECONSTRUCTION PRIVATE LIMITED 55-56, 5th Floor, Free Press House, Nariman Point, Mumbai-400 021, Tel: 91-2261894700

DEMAND NOTICE L & T Financial Services Ltd. has vide a Deed of Assignment dated 31/12/2020 assigned in favor of Pegasus Assets Reconstruction Private Limited, inter alia, the debt due and payable by you along with all its right, title, interests, benefits, under/in respect of your captioned loan account/agreement along with the underlying security and security interest created in respect of immovable property for repayment of the debt. Now under Section 13(2) of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002, ("the Act") read with rule 3 (1) of the Security Interest (Enforcement) Rules 2002. The undersigned is the Authorized Officer of the Pegasus Assets Reconstruction Private Limited ("PARPL") under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002. In exercise of powers conferred under the Section 13 (2) of the Act read with rule 3 of the security interest (Enforcement) Rules, 2002, the Authorized Officer has issued a Demand Notice under section 13 (2) of the Act, calling upon the following borrower(s)/Co-Borrower(s), to repay the amounts mentioned in the respective Demand Notice issued to them as also given below. In connection with above, Notice is hereby given once again, to the Borrowers and Co-Borrower to pay PARPL, within 60 days from the publication of this notice, the amounts indicated herein below, together with further interest as detailed in the said Demand Notice, from the date(s) mentioned below till the date of payment and/or realization, payable under the loan agreement read with other documents/writings, if any, executed by the said borrower(s). As security for due repayment of the loan, the following asset have been mortgaged to PARPL by the said borrower(s) respectively.

Table with 3 columns: Name of the Borrower(s)/Co-Borrower(s) / Guarantor(s) Mortgaged(s), Demand Notice Date & Amount, Description of secured asset (Immovable Property). Includes details for Mr. Piyushkumar Khimjibhai Shah and M/s. Remark Flour Mills Pvt. Ltd.

Description of secured asset (Immovable Property): All that piece and Parcel of Plot No 04, measuring 5040 sq.ft. in 'Ajay Colony', situated in land bearing Survey No. 40, Nr. Jain Temple, Delux Char Rasta, Nizampura, Vadodara, Baroda, Gujarat. Bounded By- East: Common Road, West: Adject Society No. 41/Bhavanipura Society, North: Plot No. 03, South: Plot No. 05.

If the said Borrower(s)/Co-Borrowers shall fail to make payment to PARPL as aforesaid, PARPL shall proceed against the above secured assets under the section 13 (4) of the Act and applicable rules, entirely at the risks of the said Borrower(s) as to costs and consequences. The borrowers/Co-borrowers are prohibited under the Act from transferring the aforesaid assets, whether by way of sale, lease or otherwise without the prior written consent of PARPL. Any person who contravenes or abets contravention of the provisions of the Act or Rules made thereunder, shall be liable for imprisonment and/or penalty as provided under the Act.

Date: 21.10.2023 Place: Vadodara Authorized Officer Pegasus Assets Reconstruction Private Limited (Trustee for Pegasus Group Thirty-Eight Trust -1)

ADITYA BIRLA CAPITAL ADITYA BIRLA HOUSING FINANCE LIMITED Registered Office- Indian Rayon Compound, Veraval, Gujarat - 362266 Branch Office- G Corporation Tech Park, Kasarvadavli, Ghodunder Road, Thane -400607 (MH)

DEMAND NOTICE (under Rule 3 (1) of Security Interest (Enforcement) Rules, 2002) SUBSTITUTED SERVICE OF NOTICE U/s.13 (2) OF SECURITIZATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002. Notice is hereby given to the borrowers as mentioned below that since they have defaulted in repayment of the Credit facility availed by them from Aditya Birla Housing Finance Limited (ABHFL), their loan accounts have been classified as Non-Performing Assets in the books of the Company as per RBI guidelines thereto. Therefore, ABHFL has issued demand notices under section 13(2) of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (SARFAESI Act) on the last known addresses of the said borrowers thereby calling upon and demanding from them to repay the entire outstanding amount together with further interest at the contractual rate on the aforesaid amount and incidental expenses, cost, charges etc. as stated in the said demand notices. However, the demand notice is also being served by way of publication, as per Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 (SARFAESI Rules).

Table with 5 columns: S/L No., Name and Address of Borrower/Co-Borrower and Guarantor/Co-Guarantor & Loan AC No., NPA Date, Date of Demand Notice, Amount due as per Demand Notice (as on Date). Includes details for RAMESH KANOJIA, SARITABEN RAMESHBHAI KANOJIA, AMIT ARJANBHAI KHATROJA, and PARULBEN ARJANBHAI KHATROJA.

Description of the Secured Assets/Immovable Properties/Mortgaged: All that Piece and Parcel of Plot No. 194, Adjoining 48 Sq. Yard I.E. 40.18 Sq. Mts., Along With 24.88 Sq. Mts. Undivided Share In The Land Of Road & C.O.P. In 'Aradhna Platinum Park', Situated At Opp. Paper Mill, Nc. Gangadhara Railway Station, Revenue Survey No. 471, Block No. 463 Of Mejo Village, Umrahk, Ta. Bardoli, Dist. Surat, Gujarat-394310, And Bounded As - East: Adj. Soc. Int. Road, West: Adj. Soc. Int. Road, North: Adj. Plot No. 193, South: Adj. Plot No. 195. We hereby call upon the borrower stated herein to pay us within 60 days from the date of this notice, the outstanding amount (together with further interest thereon plus cost, charges, expenses, etc. thereon falling which we shall be at liberty to enforce the security interest including but not limited to taking possession of and selling the secured asset entirely at your risk as to the cost and consequences. Please note that as per section 13(13) of the SARFAESI Act, all of you are prohibited from transferring by way of sale, lease or otherwise, the aforesaid secured assets without prior written consent of the Company. Any contravention of the said section by you shall involve the penal provisions as laid down under section 29 of the SARFAESI Act and / or any other legal provision in this regard. Please note that as per sub-section (8) of section 13 of the Act, if the dues of ABHFL together with all costs, charges and expenses incurred by ABHFL are tendered to ABHFL at any time before the date fixed for sale or transfer, the secured asset shall not be sold or transferred by ABHFL, and no further step shall be taken by ABHFL or transfer or sale of that secured asset. Date: 21.10.2023 Place: Surat Sd/- Authorized Officer (Aditya Birla Housing Finance Limited)

Aadhar Housing Finance Ltd. Corporate Office: Unit No. 802, Natraj Rustomjee, Western Express Highway and M.V. Road, Andheri (East), Mumbai - 400069. Surat Parvat Patiya Branch : Shop No.3128,313, Times Galleria, Nr Saroli Village Gate, Opp Kuberji World Textile Market, Surat Kadodara Road, Surat- 395010, GJ

APPENDIX IV POSSESSION NOTICE (for immovable property) Whereas, the undersigned being the Authorized Officer of Aadhar Housing Finance Limited (AHFL) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, Demand Notice(s) issued by the Authorized Officer of the company to the Borrower(s) / Guarantor(s) mentioned herein below to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice. The borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower(s) / Guarantor(s) and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under Sub-Section (4) of the Section 13 of the said Act read with Rule 8 of the Security Interest Enforcement Rules, 2002. The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets. The borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of AHFL for an amount as mentioned herein under with interest thereon.

Table with 5 columns: S. No., Name of the Borrower(s)/Co-Borrower(s) (Name of the Branch), Description of Secured Asset (Immovable Property), Demand Notice Date & Amount, Date of Possession. Includes details for loans 1, 2, 3, 4, 5, 6, 7.

Place : Gujarat Date : 21-10-2023 Authorized Officer Aadhar Housing Finance Limited

AUCTION SALE NOTICE EDELWEISS ASSET RECONSTRUCTION COMPANY LIMITED Regd. Office : Edelweiss House, 1st Floor Off CST Road, Kalina, Mumbai 400098. CIN: U67100MH2007PLC174759

E-AUCTION SALE NOTICE FOR SALE OF IMMOVABLE SECURED ASSETS UNDER THE SECURITIZATION AND RECONSTRUCTION OF FINANCIAL ASSETS AND ENFORCEMENT OF SECURITY INTEREST ACT, 2002 READ WITH PROVISION TO RULE 6 (B) & 9(1) OF THE SECURITY INTEREST (ENFORCEMENT) RULES, 2002 ("RULES") The financial facilities of various Selling Institutions mentioned below (hereinafter referred to as "Assignor") have been assigned to Edelweiss Asset Reconstruction Company Limited acting in its capacity as trustee of various trustees mentioned clearly in column provided. Pursuant to the said assignment, EARC stepped into the shoes of the Assignor and exercises its rights as the secured creditor. That EARC, in its capacity as secured creditor, had taken possession of the below mentioned immovable secured assets under 13(4) of SARFAESI Act and Rules there under. Notice of 1530 days is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor (s) that the below described immovable secured assets mortgaged in favor of the Secured Creditor, the physical possession of which has been taken by the Authorized Officer (AO) will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" basis, for recovery of the amounts mentioned herein below due to EARC together with further interest and other expenses/costs thereon deducted for any money received by EARC from Borrower(s) and Guarantor(s). The Reserve Price and the Earnest Money Deposit are mentioned below for the property:

Table with 7 columns: Loan Ac No./Selling Institution, Name of Borrower/Co-Borrower, Trust Name, Name of Bank & Branch, Account Number & FSC Code, Total Outstanding Dues INR 19-10-2023, Reserve Price (INR), EMD (INR), Date & Time of Auction, Type of Possession. Includes details for 2278346/HDB, 50230/SRTH, and LVDRSTH000065172/EHFL.

Description of Secured Asset Schedule Property-Property Bearing Plot No. 102 on the 1st Floor Adjoining 725 Sq. Feet i.e. 67.35.47 Sq. Mts. Super Built Up Area: & 60.77 Sq. Mts. Built Up Area, Along With 16.83.87 Sq. Mts. Undivided share in the land of "Vishvas Co. Op. Housing Society Ltd.", Situated at Revenue Survey No.29B(1) (A) Paki 2 Adjoining 1769.86 Sq. Mts., T.P. Scheme No.13, Final Plot No. 226. of Mejo Adajan, City of Surat.

Property Description :Property No.1 - All Right, Title and Interest in the Immovable Property Bearing Shop No. 205 adjoining Super Built Up Area 289.96 Sq. Mts and Built Up Area 143.02 Sq. Mts and Carpet Area 138.29 Sq. Mts on the Second Floor of Building Which is Known as "Siddhivinyak Platinum" Situated on the Land Bearing R.S. No. 81, Block No. 128 Adjoining 21448.00 Sq. Mts, T.P. Scheme no. 58 (Barroll), F.P.No. 29-A, 29-B and 29-C Paki, Final Plot No. 20-A Adjoining 4355 Sq. Mts Of Village: Barroll, Sub District: Majura, District: Surat.

Property Description :Property No.2 - All Right, Title and Interest in the Immovable Property Bearing Shop No. 206 adjoining Super Built Up Area 289.96 Sq. Mts and Built Up Area 143.02 Sq. Mts and Carpet Area 138.29 Sq. Mts on the Second Floor of Building Which is Known as "Siddhivinyak Platinum" Situated on the Land Bearing R.S. No. 81, Block No. 128 Adjoining 21448.00 Sq. Mts, T.P. Scheme no. 58 (Barroll), F.P.No. 29-A, 29-B and 29-C Paki, Final Plot No. 20-A Adjoining 4355 Sq. Mts Of Village: Barroll, Sub District: Majura, District: Surat.

Property Description :Property No.3 - All Right, Title and Interest in the Immovable Property Bearing Shop No. 207 adjoining Super Built Up Area 182.62 Sq. Mts and Built Up Area 98.99 Sq. Mts and Carpet Area 94.70 Sq. Mts on the Second Floor of Building Which is Known as "Siddhivinyak Platinum" Situated on the Land Bearing R.S. No. 81, Block No. 128 Adjoining 21448.00 Sq. Mts, T.P. Scheme no. 58 (Barroll), F.P.No. 29-A, 29-B and 29-C Paki, Final Plot No. 20-A Adjoining 4355 Sq. Mts Of Village: Barroll, Sub District: Majura, District: Surat.

Table with 7 columns: Loan Account No., Name of Borrower/Co-Borrower, Trust Name, Name of Bank & Branch, Account Number & FSC Code, Total Outstanding Dues INR 19-10-2023, Reserve Price (INR), EMD (INR), Date & Time of Auction, Type of Possession. Includes details for 650002863/907 and 510003487/200/IBL.

Important Information regarding Auction Process: 1. All Demand Drafts (DD) shall be drawn in favor of Trust name as mentioned above and payable at Mumbai. 2. Last Date of Submission of EMD Received 1 day prior to the date of auction. 3. Place for Submission of Bids 1st Floor, Edelweiss House, off CST Road, Kalina, Mumbai-400098. 4. Place of Auction (Web Site for Auction) E-Auction (https://auction.edelweissarc.in) 5. Contact details Toll free Number: 1800 286 6540. 6. Date & Time of Inspection of the Property As per prior appointment. For detailed terms and conditions of the sale, please refer to the link provided in EARC's website i.e. https://auction.edelweissarc.in

Date : 21-10-2023 Place : Mumbai Authorized Officer For Edelweiss Asset Reconstruction Company Limited

ઈરાન સમર્થિત વિદ્રોહી સંગઠન પણ હમાસની મદદ દોડ્યું: પ્રથમ હુમલો અમેરિકા એક્શનમાં: ઈઝરાયેલ ભણી જતા મિસાઈલ-ડ્રોન તોડી પાડ્યા

વોશિંગ્ટન તા.૨૦ ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના તીવ્ર બની રહેલા સંઘર્ષમાં હવે ઈઝરાયેલ સિવિલિયન આરંભ રાષ્ટ્રોના એક બહુ એક ગ્રાસવાદી સંગઠનનો પણ હવે આ સંઘર્ષમાં જોડાઈ રહ્યા છે અને તેમાં યમન સ્થિત હુની સંગઠને ઊંડોલા મીસાઈલ અમેરિકી નોકાઉત્પાન યુદ્ધ જલાજલને હવામાં જ તોડી પાડ્યા હતા. હમાસ અને હિઝ્બોલ્લા વચ્ચેના યોતાના યુદ્ધ જલાજલને તેનાત કયા યુદ્ધ આરંભ દેશમાં ન ફેલાય તે જોવા છે અને તે ઉપરાંત ઈઝરાયેલની ઝડપી રાત્રે કેટલાક મિસાઈલ ઉત્પન્ન કર્યા હતા. આ મિસાઈલ ઈરાન સમર્થનના હુની વિદ્રોહી સંગઠન દ્વારા ઈઝરાયેલ પર હુમલા માટે ઊંડોલામાં આગ્યા હતા. ત્રણ મિસાઈલને હવામાં જ તોડી પાડવામાં આગ્યા હતા જ્યારે કેટલાક ડ્રોન એકેડને પણ તોડી પાડ્યા છે. અમેરિકી લશ્કરી મધ્ય પેન્ટાગોનના પ્રેસ સેક્રેટરી શિરેટીયર જનરલ પેટ રાઈડરે સત્તાવાર જાહેરાત કરી છે. યુએસએસ કારની એ જમીન પરથી જમીન પર પ્રહાર કરતા મિસાઈલ તથા ડ્રોનને ઈઝરાયેલ સુધી પહોંચવા દેવામાં આગ્યા નથી. આ મિસાઈલ યમનમાંથી લોન્ચ કરવામાં આગ્યા હતા અને તે ઈઝરાયેલના પાટનરે તેલચીવને નિશાન બનાવતા હતા. આ મિસાઈલ રેડ સી પરથી ઈઝરાયેલ બિસ્તી જતા હતા. આમ હવે અન્ય સંગઠનોએ પણ આ ઈઝરાયેલ તરફ આગ્યા હતા અને અમેરિકાને સુરક્ષિત રાખે છે.

બાયડેને ઓવલ ઓફિસથી રાષ્ટ્રને સંબોધન કર્યું

વોશિંગ્ટન, તા. ૨૦ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેને ઓવલ ઓફિસથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ તરીકે મારા માટે બંધક બનાવવામાં આવેલા અમેરિકનોની સુરક્ષાથી મોટી કોઈ પ્રાથમિકતા નથી. તેમણે વધુમાં કહ્યું કે હમાસ અને રશિયા બંને લોકશાહીને નષ્ટ કરવામાં લાગે છે. રાષ્ટ્રપતિ બાયડેને પોતાના સંબોધનમાં યુકેન અને ઈઝરાયેલને મહત્વપૂર્ણ ગણાવ્યા અને બંનેને મદદ આપવાની વાત પણ કહી હતી. પોતાના ભાષણમાં જો બાયડેને કહ્યું કે હમાસ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અલગ-અલગ ખતરાનું પ્રતિનિધિત્વ કરે છે. જોકે બંને પાડોશીઓ લોકશાહીને સંપૂર્ણ રીતે નષ્ટ કરવા માગે છે. બાયડેને કહ્યું કે આપણે પક્ષપાતી અને ગુસ્સાની રાજનીતિને એક રાષ્ટ્ર તરીકેની આપણી જવાબદારીના માર્ગમાં આવવા દઈ શકીએ નહીં. અમે હમાસ જેવા આતંકવાદીઓ અને પુતિન જેવા સરમુખત્યારોને જીતવા નહીં દઈએ. હું એવું ક્યારેય નહીં થવા દઈશ. બાયડેને કહ્યું કે અમેરિકી ઈઝરાયેલ બિસ્તી જતા હતા. આમ હવે અન્ય સંગઠનોએ પણ આ ઈઝરાયેલ તરફ આગ્યા હતા અને અમેરિકાને સુરક્ષિત રાખે છે.

રશિયાનું યુ ટ્યુબર સાથે ગેરવર્તણૂકનો વીડિયો વાયરલ નવી દિલ્હી, તા. ૨૦ યુ ટ્યુબ પર કોકો ઈન ઈન્ડિયાનામથી પેજ ચલાવતી એક રશિયાન યુ ટ્યુબર સાથે ગેરવર્તણૂકની ઘટના સામે આવી છે. આ ઘટના દિલ્હીના સરોજિની નગર માર્કેટમાં બની હતી. આ ઘટના દિલ્હીના સરોજિની નગર માર્કેટમાં બની હતી. યુ ટ્યુબર દિલ્હીના સરોજિની માર્કેટમાં એક વીડિયો બનાવી રહી હતી, ત્યારે અચાનક પાછળથી એક યુવક આવીને યુવતી સાથે મિત્રતા કરવાનું કહે છે. આ પછી યુ ટ્યુબરે તેને ઘણી સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ યુવક પણ અડગ રહ્યો. બાદમાં તે ત્યાંથી નીકળી ગયો હતો. યુ ટ્યુબરે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેના પછી લોકો ખૂબ ગુસ્સે થયા છે. એટલું જ નહીં, ગેરવર્તણૂક કરનાર યુવક સામે પગલાં ભરવાની પણ માંગ કરવામાં આવી રહી છે.

અયોધ્યા: રામલક્ષ્મણના ભવ્ય મંદિરને સ્વર્ણજડિત કરાશે અયોધ્યા: દિપાવલી નજીક રામલક્ષ્મણની મુર્તિઓના પુરત વિની રાખવા નહીં તેમજ અયોધ્યાને ભવ્ય મંદિરના આભાસ આપવા માટે અયોધ્યાને ભવ્ય મંદિરના આભાસ આપવા માટે અયોધ્યામાં અંતિમ તમકકમાં છે અને અયોધ્યામાં અયોધ્યાથી રામશ્રમ સુધી ૨૦૦ રામસ્થંભ પણ લાગશે અને મોંઝવો સહિતના વિદેશી રામલક્ષ્મણ મંદિરને પણ સ્વર્ણજડિત કરાશે. અંતિમ તમકકમાં છે અને અયોધ્યામાં અયોધ્યાથી રામશ્રમ સુધી ૨૦૦ રામસ્થંભ પણ લાગશે અને મોંઝવો સહિતના વિદેશી રામલક્ષ્મણ મંદિરને પણ સ્વર્ણજડિત કરાશે. અંતિમ તમકકમાં છે અને અયોધ્યામાં અયોધ્યાથી રામશ્રમ સુધી ૨૦૦ રામસ્થંભ પણ લાગશે અને મોંઝવો સહિતના વિદેશી રામલક્ષ્મણ મંદિરને પણ સ્વર્ણજડિત કરાશે.

IIFL FINANCE CIN: L67100MH1995PLC093797 Reg Office: IIFL House, Sun Infotech Park, Road No. 16V, Plot No B-23, Thane Industrial Area, Wagle Estate, Thane - 400604 • Tel: (91-22) 41035000 • Fax: (91-22) 25806654 • E-mail: reach@iifl.com • Website: www.iifl.com

સોનાની હરાજ નોટીસ Table with columns: S.No, Particulars, Quarter ended on, Half Year ended on, Year ended on. Includes financial data for KENVI JEWELS LIMITED.

Atul Ltd Registered office: Atul House, C I Patel Marg, Ahmedabad 380 014, Gujarat, India. Extract of standalone and consolidated unaudited financial results for the quarter / six months ended on September 30, 2023.

ELECON ENGINEERING COMPANY LIMITED CIN : L29100GJ1960PLC001082 Regd. Office : Anand-Sojitra Road, Vallabh Vidyanagar - 388 120, Gujarat. Ph: (02692) 238701 / 238702. Email: investor.relations@elecon.com Website: www.elecon.com